



ચિહ્નો નથી, ટીબીની કોઈ શક્યતા નથી

ફરી વિચાર કરો!

શું તમે જાણો છો કે કયું રોગ (ટીબી) તમારા શરીરમાં લાંબા સમય માટે નિષ્ક્રિય થઈ શકે છે? અને સુષુપ્ત ટીબી કહે છે.

તે ખૂબ જ સામાન્ય છે અને તેમાં કોઈ લક્ષણો નથી. તે કોઈ પણ સમયે સક્રિય ટીબી બની શકે છે - જો સારવાર ન કરવામાં આવે તો તે મારી શકે છે - અને તેને તમારા મિત્રો અને કુટુંબીજન પહોંચાડી શકાય છે જો તમારી ઉંમર 16થી 35 વર્ષની હોય અને તમે છેલ્લા 5 વર્ષમાં નીચેનાં વિસ્તારો થી મોટાભાગના દેશોમાંથી આવ્યા હોવ તો તમને સુપ્ત ટીબીનું જોખમ વધુ છે.

:

લેટિન અમેરિકા, કેરેબિયન, આફ્રિકા, એશિયા
પૂર્વ યુરોપ, રશિયા

જો તમે આ છો:

તમને લોહીની તપાસ દ્વારા તમને સુષુપ્ત ટીબી માટે ઝડપથી
અને સરળતાથી પરીક્ષણ કરી શકો છો



ઈમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સારવાર અને પરીક્ષણ નિ:શુલ્ક છે,

તમારા નિ:શુલ્ક સુપ્ત ટીબી પરીક્ષણ માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે સંપર્ક કરો
આના પર ટીબી સેવા **024 76964169**

ટીબી અને યુકેના લેટન્ટ ટીબી સ્ક્રિનિંગ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને
www.thetruthabouttb.org/latent-tb/ પર જાઓ



પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન = મને વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે હું ટીબીથી રોગપ્રતિકારક છું અને મને ટીબીની રસીની જરૂર નથી કારણ કે મારા હાથ પરના પરીક્ષણમાં તે બતાવવામાં આવ્યું છે.

• એ = ટીબીથી કોઈ રોગપ્રતિકારક નથી; તે પછીથી તમને ટીબી થઈ શકે છે અને તમારે સુષુપ્ત ટીબી માટે તપાસ કરાવવી જોઈએ. ઉપરાંત, ભૂતકાળમાં સકારાત્મક પરીક્ષણનો અર્થ એ થઈ શકે છે કે નિષ્ક્રિય સૂક્ષ્મજંતુ હોઈ શકે છે અને તેમ વિષયમાં ગમે ત્યારે સક્રિય થઈ શકે છે.

પ્ર = મને ટીબીની રસી મળી હોવાથી હું સુરક્ષિત છું

એ = જો તમે બાળકપણ માં તરીકે ટીબીનું રસીકરણ કરાવ્યું હોય તો પણ તમને ટીબીનો ચેપ લાગી શકે છે કારણ કે સમય જતાં રસીની અસરકારકતા ઓછી થાય છે તેથી તમારે સુષુપ્ત ટીબી માટે તપાસ કરાવવી જોઈએ.

સવાલ : મારી ટીબી નો એક્સરે થયો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.

એ = સુપ્ત ટીબી સક્રિય ટીબી કરતા અલગ છે અને છાતીના એક્સરે માં દેખાતો નથી, તમારે તપાસ કરાવવી જોઈએ.

સક્રિય ટીબીના લક્ષણો જાણો, જો તમને નીચેનામાંથી એક અથવા વધુ લક્ષણો હોય તો તમારે ડોક્ટરને મળવા જવું જ જોઈએ.

- સતત ઉધરસ (જે ૩ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલે છે)
- ગળફામાં લોહી સાથે ઉધરસ
- ૨ અઠવાડિયાથી વધુ સમય સુધી તાવ
- છાતીમાં દુખાવો
- વજન ઘટાડવું
- રાત્રે પરસેવો વળે છે
- ભૂખ ન લાગવી